



ઓગષ્ટ - ૨૦૨૧
અંક - ૩૮



GSECL



સંપાદકીય બોર્ડ
- શ્રી એચ.જી. દવે
- શ્રી એસ.જી. મહેતા
- શ્રી એમ.એમ.કક્કર



અનુક્રમણિકા

- ✿ Independent India
- ✿ પંપા
- ✿ MAA
- ✿ દુઃખની જીવા કે સુખનું રિઝર પસંદગી આપણી
- ✿ કાચની બોટલમાં મની ખ્લાંટ
- ✿ ઓનલાઈન શિક્ષણનો મારો અનુભવ
- ✿ મારુ જુવન એજ મારો સંદેશ
- ✿ યાણકય - મહાન અર્થશાસ્ત્રી
- ✿ વ્યક્તિત્વના દુશ્મનો
- ✿ ગોરીપ્રત અને વિજ્ઞાન
- ✿ શાળા ની પ્રૃત્તિઓ



તંત્રી સ્થાનેથી

સર્વે શુઅમકીસી , શુઅસઈસીએલ કર્મચારી ભાઈઓ-બહેનો , શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓ સૌને સાદર વંદન “અરુણોદય” ઓગષ્ટ- ૨૦૨૧ , અંક-૩૮ ને આપ સર્વની સમક્ષ રજુ કરતાં ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું.

તંત્રી સ્થાનેથી સર્વેને હું આ અરુણોદય અંકમાં આપ દ્વારા કોઈપણ લેખ આપવામાં આવશે તો તે સ્વીકાર્ય રહેશે. જેથી આજના આ ઓનલાઇન જ્માનામાં સુંદર લેખો વાંચવા માટે અને લખવા માટે કર્મચારીઓ તથા તેમના આંક્રિતો પ્રેરિત થશે અને વધુમાં વધુ લેખો આપણે આ અંકમાં સમાવી શકીશું.

તંત્રી



Independent India



Chanchu Rekhaben J.
Secondary teacher Eng.med.

On 15th August 2021 India will complete 74 years of being independent. We attained freedom only from slavery of British but still we are slave of many issues in our country. When we will be free from all these issues we can say in real sense that India is independent . In language of a teacher these issues can be represented as follows.

A	Attack	B	Bomb	C	Corruption	D	Donation
E	Environment	F	Fraud	G	Gangrape	H	Hoarding
I	Inflation	J	Justice	K	Killing	L	Languism
M	Malpractice	N	National integrity	O	Over population		
P	Poverty	Q	Qurrel	R	Riot	S	Sucide
T	Terrorism	U	Unemployment	V	Violation		
W	War	XYZ	XYZ problem but we proud of our country.				

પાપા

મમ્મી એટલે પપ્પા નથી, એ વાત નાની નથી,
પપ્પા અધૂરા મમ્મી પૂરી, એ વાત સાચી નથી.

આ પપ્પા એટલે ?

પપ્પા એટલે ખાલી એક નામ ?

પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?

પપ્પા એટલે ખાલી એક પદ ?

પપ્પા એટલે ખાલી બાયોડિટામાં

નામની પાઇળ લાગતું અસ્તિત્વ ?

ના....

પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેક્ટિકલ પ્રેરણાદાઈ પુસ્તક...આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માથી ધારણા પુરાણો વાચવાની અને સમજવાની વાતો કરે છે પણ ધરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...આ પપ્પા નામે પ્રોફ્ઝાઈલને ડેટિટ સાથે

બહુ લેવાદેવા નહીં.. મા ને ઈશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..કારણે આ પપ્પાએ કોઈ દિવસ પોતાની જાતને ઈશ્વરની કેટેગરી માટે નોમીનેટ કર્યો જ નથી.

"ખબરદાર જો આમ કર્યું છે તો....

આવવા દે તારા પપ્પાને...

બધ્યું જ કહી દઈશ" આવા વાક્યો દરેક મા એ ક્યારેક ને ક્યારેક પોતાના બાળકને નાનપણમાં કચાં જ હશે..અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુષ્મન બની જય છે. અને અજાણુંતા જ સંતાનો સાથેનું આ છેટું ધાણું લાંબું ચાલે છે. ધારણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજય છે ત્યા સુધીમાં બાપ ખીલ્ખી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે, બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અધરા શ્લોકના ગાન કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય,

ધરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો કોસ કરતા ટૂક છેક પાસે આવી જાય ત્યારે તો મહોં માથી "ઓ બાપ રે" જ સરી પડે છે.. જે એ વાતની સાબીતી છે કે નાની નાની તકલીફો માં મા યાદ આવે... પણ જીવનની અધરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે. પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કણા મોટા બાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણ્ણવા કરતા ગળાવે છે વધુ. કોઈ બાપ પાર્ટ ટાઈમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો કુલ ટાઈમ જ કરતો હશે.. કારણે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવર ટાઈમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સંઘળી સવલતો આપવા જ સજજ થતો હોય છે, આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાઈડ થઈ જતો બાપ ચીડાઈ ને પિતૃત્વથી રીટાઈડ નથી થઈ જતો.. એને પળે પળ આપણું કશું એટલા માટે શીખવાડવું છે કારણે જીવનમાં જ્યાં જ્યાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઈએ..

NARENDRASINH S. SODHA
ATPS, NANI CHHER

બુદ્ધિધનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ
સતત કરતો રહે છે.. આ કારણોસર એ
મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપનની છતીમાં રહેલું
લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતું નથી.

આ પણ એટલે ઈ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભાગવા બેસવાનો ઓર્ડર નહીં પણ ભાગતરની
કિંમત સમજવતું એક સુવાક્ય..

આ પણ એટલે રાત્રે જ્યાં સુધી ધરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંયકાનો કિચુડ કિચુડ અવાજ
આ પણ એટલે મમ્મી કરતાં પણ વધુ વધુ લાલની ઉપર પહેરેલું કડકાઈનું મહોર
આ પણ એટલે એકવાર ખાઈ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર આપાતી ચોકલેટ
આ પણ એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાર્ટલ આઈકોન બની
જય

આ પણ એટલે આપણને કહિ યે પડી ન જવા દેનો સાઈકલની સીટની પાઇણથી પકડેલો મજબુત
હાથ...

આખરે પણ એટલે પણ...
બસ આમ જુવો તો કશું જ નહીં
અને આમ જુવો તો બધું જ...

હજ્યે સમય છે..જો પણ નામનું લાગણી નું સરનામું જવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું
હોય તો આ લેખ પુરો
કરીને અને જઈને એક વાર કોઈજ કારણ વગર ભેટી પડજો....
આદેશ ભગવાન

MAA



All worries gets flutter when MAA is there,

A bond of love and a never ending care,

For in this world, that is quite rare.

MAA when you are there I have nothing to fear.

World says I have grown up...yes its true,

But still while crossing a road someone holds my hand that's you,

And whenever in life I have got screwed,

Your ABC about life has always got me rescued.

I know I have came very far away from you MAA

Your hands are now twisting with age and years of work,

Your hand now needs my gentle touch to rub away the hurt,

But MAA your hands are more beautiful than anything can be,

And your hands are the reason that today I am me....

Puneet Singh
Overman,
Umarsar Lignite Project



કુંખળી ખીણા કે સુખનું રિશર પરસંદગી આપણી



વી.જી. રાહોડ
ઉચ્ચ. માધ્યમિક શિક્ષણ



એક નગરમાં બે ભાઈઓ રહેતા હતા . એક બદમાશ અને દાડુંદિયો હતો , તો બીજો નગરનો પ્રતિષ્ઠિત વેપારી હતો . બધા લોકોને એક જ સવાલ થતો કે બન્ને ભાઈઓ એક જ પિતાના સંતાન છે. એક જ ઘરમાં મોટા થયા છે. એક જ શાળામાં ભાણ્યા છે અને આમ છતાં બંને વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે?. નગરના એક પ્રતિષ્ઠિત સજ્જનને આ તફાવતનું કારણ આણવાની ઈચ્છા થઈ . આથી એમણે બંને ભાઈઓને ડુબડુ મળવાનું નક્કી કર્યું. આ સજ્જન પ્રથમ દાડુંદિયા ના ઘરે ગયા. પેલો તો દાડું ઢીચીને પડ્યો હતો ઘરમાં . સજ્જને તો ઘરે જઈને આડીઅવળી વાતો કરવાના બદલે સીધું જ પૂછી નાખ્યું , તમારી આવી ખરાબ પરિસ્થિતિ માટે કોણું જવાબદાર છે? દાડુંદિયાએ કદ્યું મારી આવી પરિસ્થિતિ માટે મારા પિતા જવાબદાર છે. સજ્જને કદ્યું તમે મને સમજાવશો કે તમારી આવી ખરાબ હાલત માટે તમારા પિતા કેમ જવાબદાર છે?.

પોતાનો બળાપો કાઢતા એ બોલ્યો મારા પિતાને પણ દાડની અને જુગારની આદત હતી કાયમ દાડું ઢીચીને આવે અને ઘરમાં ઝઘડા થાય એની અસર મારા પર પડી અને હું પણ મારા બાપ ની જેમ આ દાડના રવાડે ચડી ગયો .

પેલા સજ્જન હવે ગામના પ્રતિષ્ઠિત વેપારીના ઘરે ગયા અને તેમને પણ આવો જ સવાલ પૂછ્યો . તમારી આવી સારી પરિસ્થિતિ માટે કોણું જવાબદાર છે?. નગરના એ વેપારીએ જવાબ આપ્યો મારી આ સારી પરિસ્થિતિ માટે મારા પિતા જવાબદાર છે.

જવાબ સાંભળી ને સજ્જન ચોકી ગયા ! એક ભાઈની ખરાબ અને બીજા ભાઈની સારી સ્થિતિ માટે એના પિતા કેવી રીતે જવાબદાર હોઈ શકે?. એણે જ્યારે આ બાબતે સ્પષ્ટતા કરવા કદ્યું ત્યારે વેપારી ભાઈએ કદ્યું મારા પિતાને દાડ અને જુગારની આદત હતી. મેં મારા પિતાની આ સ્થિતિ જોઈ ત્યારે જ નક્કી કર્યું હતું કે મારે મારા પિતા જેવું જીવન નથી જીવનું. મારે મારા પરિવાર ને તમામ ખુશીઓ આપવી છે જે મારા પિતા એમના પરિવારને નહોતા આપી શકતા અને આજે તમે એનું પરિણામ જોઈ રહ્યા છો.

જીવનની કોઈપણ ઘટનાને કેવી રીતે મૂલવવી તે આપણા હાથની વાત છે. જો નકારાત્મક વિચારવાની ટેવ હશે તો એ આપણને દુઃખોની ઊંડી ખીણ તરફ લઈ જશે અને જો હકારાત્મક રીતે વિચારવાની ટેવ હશે તો એ આપણને સુખના શિખરો તરફ દોરી જશે. ક્યાં જવું છે તે આપણે જ નક્કી કરવાનું છે .

કાચણી બોરલમાં માણી પ્લાન્ટ



"કાચણી"
કાશ્મીરા લિમાંથુ ગોર

હું તને બહુ પ્રેમ કરુ છું; મનિષા.

એવું હું મનમાં ધણી વાર વિચારું છું

પણ જ્યારે 10.35ની લોકલ પકડીને અંધેરી થી બોરીવલી પહોંચું છું. ત્યારે ભુખ અને થાક થી તને કહેવાનું જ ભૂલી જાઉં છું.

લોકલ ની વિન્ડો સીટ પર બેસી તારા વિષે જ કવિતા લખું છું.

પણ ઘરે આવી તારા માથા પર હાથ ફેરવતાં ફેરવતાં તને સંભાળવા નો સમય જ ક્યાં છે.

મને સમજાતું જ નથી કે ક્યા પૈસા પાછળ હું દોટ મુકું છું!

કઈ ખ્યાતિ ને પકડવા હું આટલો હાંકું છું.

આ મુંબઈ છે અહીં ક્યાં કોઈ કોઈ ને ઓળખે છે?

જે ને હું મારી જિંદગી નો હિસ્સો માની બેઠો છું એ લોકલ ટ્રેન ની રહ્તાર છે.

B.P, colstroval, અને sugar level થી જોડાઈ ગઈ છે.

હા, મારી માં _

બધા ને કહે તી ફરે છે કે _

મારો દીકરો મુંબઈ વસે છે.

બહુમાળી ઈમારત મા કામ કરે છે. અને બહુ મોટો પગાર પાળે છે

પણ તૂ અંને નથી જાણતી માં કે _

અહીં ન તો ખુશ થાવા માટે સમય છે કે ન તો રડવા માટે સમય છે.

તૂ ગામડે કેટલી સુખી છે માં.

રૂપિયા તો કમાઈને 'બાપુ' અંને લાવતાં હતા.

તૂ મારી આંગળી પકડી ને બધોરે ભાત દેવા ખેતરે જતાં. ત્યારે આપણે દૂર થી જ આવતા જોઈ બાપુ હળ મૂકી દેતા.

આપણે સૌ ભેળા મળીને ખાઈ લેતા.

બાપુ, જરાક તારાં ખોળામાં માથું ટેકવીને _આટલું જરૂર કહેતા "ગગા" તારી બા દાળ બુઉ સારી બનાવે.

આટલા રૂપિયા કમાઈ પણ બાપુ આપણે ને કેવા સુખી રાખતા "બા".

આજે હું હોસ્પિટલ મા છું. થોડોક આરામ છે. તમને બધા ને યાદ કરુ છું. જરાક બેદરકારી મને હમેશાં તમારાં બધા થી દૂર કરી દેત.

અસુરક્ષા, અસલામતી, બદ્ધીર શું છે _

એ ત્યારેજ ખબર પડે જ્યારે મૌત હાથ તાલી પાડી નીકળી જય.

આહિ મુંબઈ મા હું કાચ ની બોટલ માં મની પ્લાન્ટ જવો યોઈ જ્યો છું.

જીવું તો છું પણ _

ખબર જ નથી કે મુળ નથી વધતાં કે

પાન નથી વધતાં?

લીલોછમ હું દેખાવ છું પણ મારા માથે નથી જમીન ક નથી આકાશ.





ઓનલાઈન શિક્ષણનો મારી અનુભવ



કુ. બેન.વી. સૌરઠીયા
કદ્ય.માધ્ય.શિક્ષક

કહેવાય છે કે “અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક” છે જે માહિતી ધ્રુવી વખત પુસ્તક માંથી શીખવા ન મળે તે માહિતી જત અનુભવથી પ્રાપ્ત થતી હોય છે. પરિસ્થિતિ કે સંજોગો માણસને ઘડે છે.

હાલનો સમય જે મહામારી નો છે તેવા સમયે શિક્ષણ , વ્યાપાર – ઉધોગ , અર્થાત્તર અને ખાસ કરીને સામાજિક જીવન ઉપર તેનો ધેરા પ્રત્યાધાતો વર્તાઈ રહ્યા છે. સમગ્ર અર્થવ્યવસ્થા , સમાજવ્યવસ્થા જ્યાં વેર વિઝેર થઈ ગઈ છ.

વાત કરવી છે ઓનલાઈન શિક્ષણ દ્વારા મળેલા જત અનુભવની . કોરોનાની બીજી લહેર ચાલુ થઈ તે પહેલાં એવું લાગતું હતું કે જેવી મહામારી ની અસર ઓછી થશે કે તરત જ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ જશે. પરંતુ એમ ક્યાં આ મહારોગ જવાનું નામ લે તેવો છે.

શ્રી એસ.કે.વી. વિધાલયમાં મેં જ્યારે તા. ૦૩/૦૭/૨૦૨૧ થી ધોરણ – ૧૨ માં ઓનલાઈન શિક્ષણ Zoom App. પર આપવાનું ચાલુ કર્યું ત્યારે શરૂઆત એટલી સરળ ન હતી. કારણ એક તો મારો ઓનલાઈન નો આ પ્રથમ અનુભવ. વળી, કવરેજ અને નેટવર્કના પ્રશ્નો તો ખરા જ . શરૂઆતના એક – બે દિવસ તો જાણે માનસિક થાક લાગી ગયો. વિજાણું સાધનની મદદથી ભણાવવામાં આપણે પણ ધ્રુવી વખત યંત્રવત બની જતા હોઈએ છીએ.

સામે પક્ષે વિધાર્થીઓને નેટવર્ક ના અભાવે આપણો અવાજ સ્પષ્ટ સંભળાય નહિ , ભણાવવાની એકસૂત્રતા જળવાય નહિં એટલે વિધાર્થીઓ ફરિયાદ કરેકે મજા નથી આવતી . ઉપરાંત કેટલાયે દિવસ પછી વિધાર્થીઓએ ભણાવવાનું ચાલુ કર્યું એટલે એમ ક્યાં જલ્દી તેઓની આળસ ઊડવાની હતી.

ઓનલાઈન શિક્ષણ વખતે મેં એ પણ અનુભવ્યું કે જે રીતે વર્ગખંડમાં શિક્ષકના હાવભાવ , Eye contact થી ભાણે છે તેવો સંતોષ તેમના પક્ષે ન હતો. ઉપરાંત બધા વિધાર્થીઓ રસ સાથે ભાણે છે તેવું આપણે કેમ માની શકીએ ?

શિક્ષણ જીવની પ્રક્રિયા છે. શિક્ષકના સાંનિધ્યમાં વિધાર્થી જે પ્રાપ્ત કરે છે તે વિધાર્થી માટે અમૂલ્ય ભાયું છે. જે વિધાર્થનિ ખરેખરે ભણાવું જ છે તેમના માટે ઘર કરતાં શાળા વધુ વહાલી લાગે છે. સાથો સાથ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ તે વિસ્તારના બધા વિધાર્થીઓ સધાર પણ નથી. એટલે તેમના માટે વધારાના કોઈ ખર્ચો પરવડે તેમ નથી. શાળામાં મળતું નિઃશુલ્ક શિક્ષણ તેમના માટે આશીર્વાદૃદ્ધપ છે.

ઇતાં એમ કહી શકાય કે “સમય વર્તે સાવધાન” . જેવો સમય તે પ્રમાણે ચાલવું પડે. “નહિ મામા કરતાં કાણો મામો સારો.” એ રીતે શાળાઓ જ્યારે બંધ હતી ત્યારે ઓનલાઈન શિક્ષણ જેમણે મેળવ્યું છે તેમને ફાયદો પણ થયો છે. ટેકનિકલ યુગમાં ટ્રેઈન્ડ થવું વધારે જરૂરી છે. એમ ઓનલાઈન શિક્ષણથી વિષય વસ્તુને લગતી બહોળી માહિતી વિધાર્થીઓને જરૂર મળતી હોય છે. પણ મને જે મજા હાલમાં ઓફલાઈન શિક્ષણથી આવે છે તે ઓનલાઈનમાં આવતી ન હતી. કારણ વિધાર્થીઓ જ શિક્ષકની સાચી મૂડી છે. તેમને દૂર કરતાં શિક્ષકના સાંનિધ્યમાં શિક્ષણ મળે તે વધુ વ્યાજબી લાગે છે.

વધુ વાતો ફરી ક્યારેક શેઅર કરીશ.

મારુ જીવન એજ

મારો સંદેશ

વાચક મિત્રો,



બેસ. બેસ. ભગોરા
માધ્યમિક શિક્ષણ

સૌને નમસ્કાર, આજાઈના ઉપમાં વર્ષના પર્વ ના શુભ અવસરે દેશની આજીવન સેવા કરવામાં અને ભારતમાતાને વિદેશી સત્તાની ગુલામી માંથી મુક્ત કરવા જેમણે પોતાની આખી જિંદગી ન્યોધાવર કરી હતી તેવા તમામ દેશભક્તો, સ્વતંત્રયવીરો તથા દેશભક્ત મહાત્મા ગાંધીજીને કોટી કોટી વંદન.....

ગાંધીબાપુનું જીવનનો એક યજ્ઞ સમુ હતુ. વિધાર્થી અવસ્થામાં નાની વયે અજાણપણે થઈ ગયેલી કેટલીક સહજ ભૂલો છતાં ભૂલોની જહેરમાં કબૂલાત કરી તેને સુધારવા મથતા આ મહામાનવે પોતાની જીવનની સોનેરી અને પ્રેરક સંદેશની બાયોગ્રાફી 'સત્યના પ્રયોગો' અથવા 'આત્મ કથા' નામે પ્રસિધ્ધ કરી. આજે વિશ્વનું આ અમૂલ્ય નજરાણું વિશ્વની અનેક ભાષાઓ માં અનુવાદિત થઈ લાખો આવૃત્તિઓ ધરાવે છે. આ પુસ્તક વિધાર્થી અને શિક્ષક - દરેક વાલીઓએ અચૂક વાંચવું જોઈએ.

ગાંધીજીનું વ્યક્તિત્વ અત્યંત ગતિશીલ, મોહ વગરનું અને નિર્મળ હતું. ખુલ્લા મનના સત્ય શોધકને છાજે એવી નમ્રતા સાથે વિનોદવૃત્તિ પણ તેમના સ્વભાવમાં જોવા મળે છે. તેમનું જીવન સાદગી, સંયમ, ચોકસાઈ, ચીવટ, સ્વચ્છતા, નિયમિતતાથી શોભતુ હતું.

'મારું જીવન એજ મારો સંદેશ છે' એવું તેઓ કહેતા હતા. દક્ષિણ આહ્વિકામાં રંગ ભેદની નીતિ સામે સત્યાગ્રહ આદ્યો. ત્યાંના લોકોને થતો અન્યાય દૂર કર્યા. તેમને ભારતમાં સ્ત્રી શિક્ષણ, અસ્પૃશ્યતા નિવારણ, નિરક્ષરતા નિવારણ, કુરિવાજો, દારુબંધી, ગામડાઓનો ઉધ્ધાર, દલીતોધ્ધાર, સ્ત્રી સ્વાતંત્ર્ય જેવા એ સમયના અનેક પ્રશ્નો સામે ભારે લડત ઉપાડી. જીવન જીવવાની એક નવી જ વ્યવહાર, રીત એમણે આચરી બતાવી. અમદાવાદમાં સાબરમતી અને દેશના અન્ય વિસ્તારોમાં આશ્રમો સ્થાપ્યી દેશ સેવકો તૈયાર કર્યા. તેઓ સ્વદેશી ચીજોના ભારે હિયાયતી હતા. તેમને અનેક વાર જેવવાસ વેઠ્યો. આમરણાંત ઉપવાસો કર્યા. ગરીબોની હાલત નિહાળી પોતાના દેહ પર વણેલું ખાદીનું માત્ર એક કપદું જ આજીવન ધારણ કર્યું. ખાદી, ચરખા દ્વારા સ્વાવલંબી થવાનો સંદેશ આપ્યો. સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને તેમણે આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું.

- અસ્તુ -



ચાણક્ય - મહાન અર્થશાસ્ત્રી



પી.બી. પટેલ
ઉદ્યમાંસિક શિક્ષક

ભારતીય ભૂમિ તેજસ્વી નરરત્નોની ખાળ છે. એક એક તત્ત્વ માટે જીવન જીવી ને દુનિયાને કંઈક ને કંઈક શ્રેષ્ઠ મૂલ્યો પૂરા પાડ્યા છે. ભારતીય સંસ્કૃતિ દુનિયાની બીજી બધી સંસ્કૃતિ કરતાં ચઢિયાતી મનાય છે. મહાપ્રતાપી રાજાઓ, પ્રધાનો, વિદ્વાનો આ ભૂમિ ઉપર પાક્યા છે.

વાત કરવી છે પ્રચંડ મેઘાવી એવા ચાણક્યની. એવું કહેવાય છે કે આજે પણ ચાણક્યની મુત્સદીગીરી, રાજનીતિ, ચાણક્યના નીતિ સૂત્રો એટલા જ જગવિષ્યાત છે.

ચાણક્ય મહાન અર્થશાસ્ત્રી, રાજકારણી, પોલિટિકલ સાયન્સમાં પારંગત, ન્યાયપ્રેમી, દાર્શનિક વિદ્વાન હતા. તેમણે અર્થશાસ્ત્રનો એક ગ્રંથ લખ્યો છે જેની તોલે આજ સુધી લખાયેલા અર્થશાસ્ત્રનો કોઈ પણ ગ્રંથ આવે નહિ.

ચાણક્ય મહાન શિક્ષક હતા. તેમણે શિક્ષકોનું ગૌરવ વધાર્યું છે. તેમણે શિક્ષક વિશે કહ્યું “ શિક્ષક કબી સાધારણ નહી હોતા, ઉસકી ગોદમે સર્જન અને વિસર્જન પનપતે હે ”.

એક વખત ચીનથી એક ડેલિગેટ ગ્રુપ પાટલીપુત્ર (પટણા) માં અભ્યાસ કરવા આવ્યું. તેમાં ચીનના મોટા મોટા વિજ્ઞાનીઓ, ઉધોગપતિઓ હતા. તેઓ પાટલીપુત્રમાં એક સપ્તાહ રહ્યા અને આખા પાટલીપુત્રનો અભ્યાસ કર્યો. તમના ઘર, રીતિ પદ્ધતિ, ભવ્યતા, પટનાના મહાલયો, રસ્તા, બાગ બગીચા વગેરે જોઈને ડેલિગેટ ગ્રુપ ખુબ જ પ્રભાવિત થઈ ગયું. તેમને થયુકું આ આખું નગર ભવ્ય અને સુખી છે તો તેનો પ્રધાન અમાત્ય કેવો હશે અને ક્યાં રહેતો હશે? . તે ગ્રુપે કહ્યું કે અમારે સમાટ ચંદ્રગુપ્તના પ્રધાનને મળવું છે. એક અધિકારી તેઓને પાટલીપુત્ર બહાર ગંગાકિનારે લઈ ગયા તો ત્યાં એક તેજસ્વી વિદ્વાન જાડ નીચે આસન પાથરી બેઠા હતો અને બાજુમાં તેની સુદર સ્વરચ્છ ઝુંપડી હતી. સાથે આવનાર અધિકારીએ ડેલિગેટ ગ્રુપને કહ્યું કે જુઓ ત્યાં સામે જે બેઠા છે એ અમારા પ્રધાન છે. ડેલિગેટ ગ્રુપના સભ્યો ચક્કિત થઈ ગયા. તેમણે પછી ચાણક્ય સાથે એક કલાક સુધી વાર્તાવાપ કર્યો. ચાણક્યના જ્ઞાન અને વર્તનથી તેઓ બહુ પ્રભાવિત થયા હતા. છેવટે ગ્રુપના અધ્યક્ષો ચાણક્યને એક અંતિમ પ્રેરણ પૂછ્યો : આટલા ભવ્ય અને વિશાળ સામ્રાજ્યના તમે મહા અમાત્ય છો, તેમ છતાં ઝુંપડીમાં કેમ રહોછો? ત્યારે ચાણક્યે કહ્યું કે જ્યારે અમાત્યો મહેલમાં રહેવા લાગશે ત્યારે પ્રજાને ઝુંપડીમાં રહેવાનું થશે. કેટલી માર્મિક વાત ચાણક્ય એ તે ગ્રુપ ના અધ્યક્ષને કહી. આજે વિલધ વર્તન જોવા મળે છે. કહેવાતા નેતાઓ આજે મહેલમાં રહે છે અને પ્રજા ઝુંપડીમાં. ચાણક્યને સમજવા માટે આપણી બુધ્યિ ટૂંકી પડે.

આવા તેજસ્વી બુધ્યિ પ્રતિભા ધરાવનાર ચાણક્ય ને શત શત નમન.

વ્યક્તિગતા કુરુમણો



શ.આર.ડાવની
ચેય.માધ્ય.સિફારાઝ

આપણું ઘડતર આપણા હાથમાં છે. આપણા વ્યક્તિત્વમાં ઘણી બધી ટેવો નકારાત્મક સ્વભાવ તરીકે આપણી સામે આવતી હોય છે. જો વ્યક્તિ આ ટેવો વિશે વિચાર કરી તેમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે તો તે પોતાના વ્યક્તિત્વને આકર્ષક બનાવી શકે છે. આથી વ્યક્તિએ પોતાની જતે જ પોતાના વ્યક્તિત્વનું સ્વમૂલ્યાંકન કરવાનું છે. ઘણીબધી ખરાબ ટેવોને સ્વીકારીને તેમાંથી મુક્ત થવાનો ખરા હૃદયથી પ્રયત્ન કરશે તો વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને સુંદર બનાવી શકે છે. આવો કેટલાક નકારાત્મક નિર્ણયોને દૂર કરી આપણા વ્યક્તિત્વને નિખારીએ.

1. નિર્ણય કરવામાં અસક્ષમ. :-

ઘણીવાર વ્યક્તિ પોતે યોગ્ય નિર્ણય લઈ શકતી નથી, અમુક નિર્ણયો માટે તેને બીજા ઉપર આધાર રાખવો પડે છે. પરંતુ નિંદગીમાં વ્યક્તિ માત્ર બીજાના નિર્ણય ઉપર જ આધાર રાખે તો વ્યક્તિ પરાવલંબી બની જાય છે. અને હંમેશા બીજાના સહારે જીવનું પડે છે. કેટલીક વખત તમારા નિર્ણયો સાચા ન હોય એવું પણ બને, પણ તેમાંથી તમે પરિપક્વ થતા જશો અને એક એવો સમય આવશે જ્યારે તમે તમારા નિર્ણયથી પોતાના વ્યક્તિત્વને ઉત્તમ દિશા તરફ લઈ જઈ શકશો. તમે તમારી નિર્ણયશક્તિને વિકસાવો.

2. આગસ્તુ સ્વભાવ :-

વ્યક્તિના વ્યક્તિત્વને વિકસાવવામાં આગસ નકારાત્મક ભૂમિકા ભજવે છે વ્યક્તિને અમુક ઘરેડમાં કામ કરવાનું ગમે છે. રૂટિન કાર્ય કરવાથી વ્યક્તિ કંટાળે છે. "આ શું રોજ આનું આ જ" આવો સ્વભાવ વ્યક્તિના જીવનમાં આગસ પેદા કરે છે. પરંતુ વ્યક્તિએ પોતાના કામમાં સર્જનવૃત્તિ અને વિશિષ્ટતા લાવીને એને આનંદમય બનાવવું જોઈએ. નકામી અને વ્યર્થ બાબતોથી વ્યક્તિમાં આગસ આવે છે, અને "આગસ એ જીવતા માણસ ની કબર છે" જે તેના વ્યક્તિત્વને ઝંથે છે.

3. ઉતાવળ :-

કેટલીક વખત વ્યક્તિને તેની ઉતાવળ તેના ઉત્તમ વ્યક્તિત્વને અવરોધે છે. અને આથી જ વ્યક્તિએ અમુક નિર્ણયોમાં અમુક બાબતોમાં ધીરજથી વર્તવાનું રહેશે. ખોટી ઉતાવળ તેને નુકસાન પહોંચાડી શકે છે. તમે ચપળ હોવા જોઈએ પરંતુ ઉતાવળા નહીં. ઉતાવળથી વાહન ચલાવવામાં અકસ્માતને પણ નોતરી શકો છો. ઉતાવળ જીવનમાં વ્યક્તિત્વને અનહિસિસ્થિન બનાવે છે. ધીરજ ને તમારા વ્યક્તિત્વનો ગુણ બનાવી ઉતાવળથી દૂર રહો.

4. કોધી સ્વભાવ :-

કોધી જ્યારે માનવીનો સ્વભાવ બની જાય છે ત્યારે તેના વ્યક્તિત્વને ખૂબ નુકસાન પહોંચે છે. વ્યક્તિ માનસિક રીતે બેચેન બને છે જ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી શારીરિક બીમારીઓને નોતરે છે. માનસિક રીતે તો તે નુકસાની કેઢે છે, શારીરિક રીતે પણ તેને નુકસાન સહન કરવું પડે છે. કોઈનો ગુસ્સો કોઈની ઉપર કરવાથી બીજાને પણ નુકસાન પહોંચી શકે છે. ઓફિસનો ગુસ્સો પત્ની કે બાળક ઉપર ન ઉતારી શકાય. તમારું પારિવારિક જીવન અશાંત બને છે. વ્યક્તિગત અને પારિવારિક જીવન ડહોળાય છે. વ્યક્તિએ ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ. અમુક સમયે ગુસ્સો જરૂરી છે પણ તેની માત્રા પણ વધવી ન જોઈએ અને સમય પણ વધવો ન જોઈએ. આપણી ભૂલ હોય ત્યાં વિનમ્રતા પૂર્વક જતને હારિને ભૂલ સ્વીકારના ખચકાઈયે નહીં.

(વધુ આવતા અંક)



ગૌરીવત અને વિજ્ઞાન



કુવરબેન જે. દેસાઈ
અંગેજ પ્રાથમિક રિક્ષક

ગૌરીવતને લઈને આધુનિક યુગમાં ઘણી ઉપેક્ષાઓ જોવા મળે છે. જોકે ગામડાઓમાં હજુ પણ નાની-નાની બાલિકાઓ સોણે શાણગારે સજી પૂજા કરવા જતી જોવા મળે. શું આપણને પ્રશ્ન થાય કે ગૌરીવત કેમ ? મીઠા વગરનું શા માટે ખાવું ?.

આપણા ઋષિમુનિઓએ અકારણ , અમથું , અમસ્તું કશું જ આપ્યું નથી. જે જે આપ્યું છે તેની સાથે વિજ્ઞાન જોડાયેલું જ હોય છે. આ ગૌરી વતના વિવિધ પાસા ઓ જોઈએ.

** Health :-

આજના યુગમાં દીકરીને મીઠા વગરનું ખવડાવવામાં આપણું અત્યાચાર લાગે છે પરંતુ તેના અનેક ફાયદાઓ છે. જેમ કે ચોમાસામાં ઝેરી જીવ જંતુનો ઉપદ્રવ રહેતો અને જો મીઠું ન ખાઈએ થોડા દિવસ એટલે ઝેરનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધી જય તેથી જ આ વ્રત ચોમાસામાં આવે છે.

ઉપરાંત આગળ જતાં થાઈરોઇડ , બી.પી. , જેવી તકલીફો સર્જની નથી. થાઈરોઇડ જ્વેન્ડને વર્ષમાં પાંચ દિવસ આરામ મળતા ફરી સારી રીતે કામ કરે છે. સત્રીઓના શરીરનું ઓજસ જળવાઈ રહે છે.

** Mentally and Morally :-

આપણે સહૃદ જાળીએ છીએ દીકરી ગમે તેટલી Modern હોય પણ અમુક જવાબદારીઓ માંથી તે છુટી શકતી નથી. જેમ કે બાળઉછેર – બાળકની કાળજી. તે સમયે તેને જો ડોક્ટર ઓછા મીઠાનું ખાવાનું કહે તો તે કરી શકે છે. અને હા જગરણની ટેવના કારણે બાળક માટે ઉજગરો કરવો પડે તો પણ તેનું મન કેળવાયેલું હોવાથી તે કરી શકે છે.

આ ઉપરાંત પાંચ દિવસ મોણું ખાવાથી તેનામાં સંયમનો ગુણ વિકસે છે. ‘ ગમે તે પ્રલોભનો આવે , ગમે તેટલા પક્વવાન સામે હોય પણ હું મીઠા વગરનું જ ખાઈશ ’ આ મક્કમતા આવે છે. ચાલશે, ભાવશે અને ફ્રાવશે ન ખબર પડતા વિકસી જય છે. જેમ મીઠા વગરનું નથી ભાવતું છતાં ખાઈ લે છે તેમ ક્યારેક અણગમતી પરિસ્થિતિનો પણ સામનો કરી શકે છે.

** Team work :-

બીજી સહેલીઓ સાથે હળીમળીને આ વ્રત કરે છે જેમકે હળીમળીને જગવું , રમવું , પૂજા કરવી અને ન ખબર પડતા સમરસ થતાં શીખે છે.

** Aesthetically :-

સૌદર્યલક્ષી દેણી વિકસે છે અ તહેવારોમાં . કુદરતનું સૌદર્ય જવારામાં નિરખે છે. રોજ મોટા થતાં જુબે, તેની પૂજા , તેને શાળગાર , પોતે સાજ – શાળગાર સજવાનો શોખ કેળવાય અને આમ સુંદરતા લાવી શકે, જાણી શકે , માણી શકે. આપણે જોઈએ છીએ કે દીકરી સોણે શાળગાર સજી પૂજા કરવા જતી હોય તો આપણને પણ લાગે જાણે શક્તિ - સ્વરૂપા.

** આ વ્રત સ્ત્રીને જ કેમ :-

આવનારી પેઢીનું નિર્માણ તેના હાથમાં છે. જો મક્કમ મનની , સંયમવાળી , હળીમળીને કામ કરવા વાળી , સમજદાર , તંદુરસ્ત સ્ત્રીઓ જ તંદુરસ્ત , સંયમિત મનથી મક્કમ પેઢીનું નિર્માણ કરી શકે.

વ્રતના ફાયદા જોઈને વ્રત કરવાનું ન હોય તેમજ તેને અવગાણવાનું પણ ન હોય.. આપણા ઋષિઓએ અમૂલ્ય વારસો , તેજસ્વી પરંપરાઓ આપી છે તેને જાણીએ સમજીએ અને તે રસ્તે ચાલીએ તોજ ,

કૃણવંતો વિશ્વમ् આર્યમ्

ની ગર્જના કરવાના અધિકારી છીએ.

શાળા વી પ્રવૃત્તિઓ



ઓનલાઈન શિક્ષણ આપતા શિક્ષકો તથા તેમનો ઉત્સાહ લઘારતા આચાર્યશ્રી



દ્વારા લાંબા સમય બાદ
ધોરણ - ૮ થી ૧૨
ની શાળા
જીવ



ઓનલાઈન વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ